


।  
गीत



# **અનુકમણિકા**

## **૧. યોગ**

૧.૧. યોગ એટલે શું ?

૧.૨ યોગના અંગો

## **૨. યૌગિક સૂક્ષ્મ વ્યાયામ**

### **૩. યૌગિક પદ્રક્ષિયાઓ**

### **૪. રીફાઈનીંગ કસરતો**

### **૫. સૂર્યનમસ્કાર**

### **૬. યોગાસન**

૬.૧ યોગાસનનો અર્થ

૬.૨ યોગાસનનું મહત્વ

૬.૩ યોગાસનના અભ્યાસીને સૂચનો

૬.૪ યોગાસન સિદ્ધિ

૬.૫ યોગાસનના પ્રકારો

૧. પીઠ પર સૂઈને કરવાનાં આસનો

૨. પેટ પર સૂઈને કરવાનાં આસનો

૩. બેસીને કરવાનાં આસનો

૪. ઊભા રહીને કરવાનાં આસનો

## **૭. યૌગિક શોધન કિયાઓ – ષટ્કર્મ**

## **૮. પ્રાણાયામ**

૮.૧ પ્રાણાયામનો અર્થ

૮.૨ પ્રાણાયામનું મહત્વ

૮.૩ પ્રાણાયામના મહત્વના અંગો

૮.૪ પ્રાણાયામ મુદ્રા

૮.૫ પ્રાણાયામમાં ઉપયોગી બંધો

૮.૬ પ્રાણાયામના અભ્યાસીને સૂચનો

૮.૭ પ્રાણાયામની પૂર્વતૈયારીઓ

૮.૮ પ્રાણાયામના પ્રકારો

## **૯. વિવિધ રોગોમાં યોગાસન અને પ્રાણાયામ**

## ૧. યોગ એટલે શું ?

દેશમાં અને પરદેશમાં ‘યોગ’ શબ્દ ખૂબ જ પ્રચલિત થઈ રહ્યો છે. આધિ, વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપમાં બળતો માનવી આજે યોગની મહત્તમ ધીમે ધીમે સમજ રહ્યો છે. ત્યારે યોગના અર્થને સમજવા આપણે કંઈક પ્રયત્ન કરીએ.

‘યોગ’ શબ્દ સંસ્કૃતના ‘યુજ’ ધાતુ પરથી બન્યો છે. યુજનો અર્થ જોડવું, બાંધવું, મિલન કરવું, સંયોજન કરવું એવો થાય છે.

ભારતના અર્વાચીન શાસ્ત્રો તથા યુગપુરુષોએ યોગના સ્વરૂપને સમજવતી અનેક વ્યાખ્યાઓ આપી છે. એના આધારે યોગનો અર્થ સમજવા પ્રયત્ન કરીએ.

## ૨. ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ યોગનો અર્થ સમજવતાં અર્જુનને કહે છે...

**યોગ:** કર્મસુ કौશલમ् । અર્થાત् કર્મોમાં કુશળતા પ્રામ કરવી એનું નામ યોગ.

આપણી ફરજમાં આવતાં કોઈપણ કર્મો કરતાં પરમાત્માનું સમરણ અખંડ કરવું, એ રીતે કરેલાં કર્મમાં જ સાચા અર્થમાં કુશળતા પ્રામ થાય છે. એ રીતે કરેલું કર્મ સાધકને બંધનકૃપ થતું નથી. એ કર્મ નિર્ગુણ છે.

## ૩. ભગવાન શ્રીકૃષ્ણ યોગનો બીજો અર્થ સમજવતાં કહે છે...

સમત્વ યોગ ઉચ્ચતે । અર્થાત् સમતાને યોગ કહેવાય છે. એટલે કે સુખ-દુःખ, માન-અપમાન, હરખ-શોક, જય-પરાજય, લાભ-હાનિ વિગેરે ઉમિઓમાં કે દ્વંદ્વોમાં મનની સ્થિરતા રહેવી, મનનું વિભાંતિને ન પામવું, આત્મા પરથી આનંદ ન જવા દેવો એ યોગ છે.

## ૪. ભગવદ્ગીતામાં યોગનો અન્ય એક અર્થ સમજવતાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે...

દુ:ખસંયોગવિયોગ યોગસંજ્ઞિતમ् । અર્થાત્ દુ:ખ સાથેના સંયોગમાંથી મુક્તિ મેળવવી તે યોગ કહેવાય છે. જે વિવેકી છે, જે સાચા અર્થમાં સાધક છે, જે ખરેખર પરમાત્માની પ્રાપ્તિ માટે મંડચો છે એના માટે તો સાંસારિક સુખો અને દુ:ખો એ બંને દુ:ખ જ છે. એટલે કે સાંસારિક સુખ અને દુ:ખની અવસ્થાનું નામ યોગ.

## ૫. યોગસૂત્રના સમાધિપાદના બીજા સૂત્રમાં મહર્ષિ પતંજલિ યોગની વ્યાખ્યા આપતાં કહે છે...

**યોગશ્ક્રિતવૃત્તિનિરોધ:** । અર્થાત્ યોગ એટલે ચિત્તની વૃત્તિઓનો નિરોધ.

આપણું ચિત્ત અનેક પ્રકારની વૃત્તિઓથી ઘેરાયેલું છે. જે મનને સ્થિર રહેવા દેતું નથી. આપણું મન અસ્થિર, ચંચળ અને વિક્ષુબ્ધ છે. આવી અનેક વૃત્તિઓને લઈને સાધકનું મન પરમાત્મા સાથે અખંડ જોડાયેલું રહેતું નથી. એ જ્યાં ત્યાં ભટક્યા જ કરે છે. કૃષ્ણ પરમાત્મા ગીતામાં સમજવે છે કે મનને વશ કરવું એ વાયુની ગતિને રોકવા જેવું કઠિન કાર્ય છે, પરંતુ સતત અભ્યાસ અને વૈરાગ્યથી તેને વશ કરી શકાય છે.

## ૬. મહર્ષિ યાજનવલ્કય યોગનો અર્થ સમજવતાં કહે છે...

સંયોગો યોગ ઇત્યુક્તો જીવાત્મા-પરમાત્મયો: અર્થાત્ જીવાત્મા અને પરમાત્માનો સંયોગ એટલે યોગ.

## ૭. ભગવાન સ્વામિનારાયણ પોતાના પ્રાસાદિક પરાવાળીના મૂલ્યવાન ગ્રંથ વચ્ચનામૃતમાં ગઢા પ્રથમ પ્રકરણ રૂપમાં યોગની

સરળ સાધના બતાવતાં કહે છે કે “ને ભક્તની ચિત્તવૃત્તિ ભગવાનના સ્વરૂપને વિષે જોડાણી તેને યોગ(અષ્ટાંગયોગ) વગર સાથે સધાર્ણ રહ્યો છે.”

યોગનું અંતિમ ફળ સમાધિના બે ભેદ સમજાવતાં પ્રભુ કહે છે, “એક તો પ્રાણાયામે કરીને પ્રાણનો નિરોધ થાય છે તે ભેણો ચિત્તનો પણ નિરોધ થાય છે અને બીજો પ્રકાર એ છે કે ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. તે ચિત્તનો નિરોધ ક્યારે થાય છે તો જ્યારે સર્વ ઠેકાણેથી વૃત્તિ તૂટીને એક ભગવાનને વિષે વૃત્તિ જોડાય અને ભગવાનને વિષે વૃત્તિ ક્યારે જોડાય તો જ્યારે સર્વ ઠેકાણેથી વાસના તૂટીને એક ભગવાનના સ્વરૂપની વાસના થાય, ત્યારે તે વૃત્તિ કોઈની હઠાવી ભગવાનના સ્વરૂપમાંથી પાછી હો નહીં.” એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે “ચિત્તની તમામ વૃત્તિઓને ભગવાનના સ્વરૂપમાં જોડવી તેનું નામ સાચો યોગ.”

૭. યોગી ડીવાઈન સોસાયટીના અધિકારીના તથા હરિધામ તીર્થક્ષેત્રના સંતશિરોમણી ગુરુહરિ પ.પૂ. હરિપ્રસાહસ્વામીજી યોગની ઢૂંકી તથા સચોટ વ્યાખ્યા આપતાં કહે છે ...

Yoga means union with God. એટલે કે આત્માની પરમાત્મા સાથેની એકતા, આત્માનું પરમાત્મા સાથેનું સાધર્મ્યપણું - અનું નામ યોગ.

આમ યોગની વ્યાખ્યાઓ દ્વારા યુગપુરુષોએ જુદી જુદી રીતે કરી છે. પરંતુ દરેકની શૈલિ લિઙ્ગ લિઙ્ગ હોવા છતાં દરેકના સૂર એક જ છે અને તે એ છે કે અંતઃકરણમાં રહેલા રજસ્, તમસ્ અને સત્ત્વના ભાવોનો દૂર કરી, ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરી પરમાત્મતત્ત્વ સાથે સંપૂર્ણપણે જોડાવું તે.

## ૨. યોગના અંગો

મહર્ષિ પતংજলિએ તેમના યોગસૂત્રના સાધનાપાદના રદ્દમાં સૂત્રમાં યોગના આઠ અંગોનું વર્ણન કર્યું છે.

યમનિયમાસનપ્રાણાયામપ્રત્યાહારધારણાધ્યાનસમાધયોડષાવઙ્ગાનિ ॥ યો.સૂ. ૨-૨૮

તે આઠ અંગ એટલે (૧) યમ (૨) નિયમ (૩) આસન (૪) પ્રાણાયામ (૫) પ્રત્યાહાર (૬) ધારણા (૭) ધ્યાન અને (૮) સમાધિ.

શરૂઆતનાં પાંચ અંગો(યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર) ને બહિરંગ કહે છે અને છેદ્ધાં ત્રણ અંગો(ધારણા, ધ્યાન અને સમાધિ) ને અંતરંગ કહે છે.

યોગનાં આ આઠ અંગોને હવે સમજવા પ્રયત્ન કરીએ.

### (૧) યમ :

અહિંસાસત્યાસ્તોયબ્રહ્મચર્યાપરિગ્રહાયમા: યો.સૂ. ૨-૩૦

અર્થાત् અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ યમ છે.

### અહિંસા :

જીવપ્રાણીમાત્રને મન, વાણી અને કર્મથી દુઃખ ન દેવું એનું નામ અહિંસા. અન્યને દુઃખ દેનાર વ્યક્તિના ચિત્તની શાંતિ જોખમાય છે અને તેની સામાજિક અને આધ્યાત્મિક પડતી થાય છે, એટલે યોગના માર્ગ ચાલનાર સાધકે હિંસાથી હંમેશા દૂર રહેવું જોઈએ.

## સત્ય :

સત્યનો અર્થ સાચું બોલવું એવો જ નથી, પરંતુ જરા ઊંડો અને વિશાળ છે. સત્ય એ બીજું કાંઈ નહિ પણ પરમાત્માનું જ બીજું નામ છે. પરમાત્મા સત્યસ્વરૂપ છે. અતિશયોક્તિ, દંલ, ચાલાકી, બનાવટ, ડોળ આ બધું જ અસત્યાચરણ છે. વિચાર, વાળી અને વર્તનમાં એકતા એ જ સાચું સત્ય છે.

અસત્યનું આચરણ કરનાર વ્યક્તિના ચિત્તમાં પાપવિલાવના, લઘુતાગ્રંથિ, ગુંઘવણ, ભય વિગેરે અશુદ્ધિઓ ઊભી થાય છે. શુદ્ધ અને સ્વસ્થ ચિત્ત માટે સત્યાચરણ અનિવાર્ય છે. સામાન્ય વ્યવહારમાં પણ અસત્ય બોલનાર વ્યક્તિની આંખો, ચહેરો, એનું હલનચલન જ ચાડી ખાય જાય છે. જેને લઈને વ્યક્તિ એક પ્રકારની બેચેની, મૂંજવણ કે ભય અનુભવે છે. લાંબા ગાળે એનું સમગ્ર વ્યક્તિત્વ દૂષિત થઈ જાય છે. આવી વ્યક્તિ કદાપિ યોગમાર્ગ ચાલી શકે નહીં.

## અસ્તેય :

અસ્તેય એટલે ચોરી ન કરવી. બીજાની વસ્તુ તેની જાણ બહાર કે તેની પરવાનગી વગર લઈ લેવી, જે હેતુ માટે વસ્તુ મળી હોય તેને બદલે બીજ હેતુ માટે તેનો ઉપયોગ કરવો, નિર્ધારિત સમય પછી પણ તેનો ઉપયોગ ચાલુ રાખવો... આ બધી વસ્તુઓનો ચોરીમાં સમાવેશ થાય છે. અન્યનું ધન કે પદાર્થ નહિ પણ અન્યના અધિકાર, યશ, માન વગેરે પણ પોતાના બનાવવા ઈચ્છાવું એ પણ એક પ્રકારની ચોરી જ છે. યોગના માર્ગ ચાલનાર સાધકે તો પરમાત્મદર્શન સિવાય કોઈ વસ્તુની જંખના સેવવી ન જોઈએ.

## બ્રહ્મચર્ય :

બ્રહ્મચર્યનો અર્થ છે બ્રહ્મ પ્રામિ માટે આવશ્યક વર્તન. ઈન્દ્રિયોનો નિગ્રહ કરનાર, શાસ્ત્રનો અભ્યાસી અને સંયમપૂર્વક જીવન ગાળનાર બ્રહ્મચારી કહેવાય છે. સર્વ ઈન્દ્રિયોનો સંયમ માત્ર કિયામાં જ નહિ પરંતુ વિચારમાં પણ હોય તે આવશ્યક છે. કારણ વિચારોથી ભોગ અને કિયાથી સંયમ બંને લાંબો સમય ચાલે નહિ અને ચાલે તો વિકૃતિ પેદા કરે.

બ્રહ્મમાં ચરવું - વિચરવું, વિહરવું એટલે બ્રહ્મચર્ય. વિચાર અને આચારમાં સર્વેન્દ્રિયોનો સંયમ એનું નામ બ્રહ્મચર્ય. યોગ અને ભોગ બંને વિરોધી બાબતો છે. માટે બ્રહ્મચર્યના પાલન વિના યોગમાર્ગ ચાલી શકાય જ નહીં. ગૃહસ્થ માટે 'એક નારી સદા બ્રહ્મચારી' એ બ્રહ્મચર્ય છે.

## અપરિગ્રહ :

અપરિગ્રહ એટલે સંગ્રહવૃત્તિનો ત્યાગ. યોગના માર્ગ ચાલનાર સાધકે જે વસ્તુની જરૂર ન હોય તે રાખવી જોઈએ નહીં. તેવી જ રીતે તાત્કાલિક જરૂર ન હોય એવી વસ્તુ પણ સંઘરચી નહીં. ઓછી જરૂરિયાતો રાખવી અને ખરેખર આવશ્યક હોય તેટલું જ પોતાની પાસે રાખનું. ધન કે વસ્તુઓની પ્રામિ માટે તેમજ તેની જળવણી માટે સમય અને શક્તિ આપવા પડે ને મન પર તેની ચિંતા રહ્યા કરે છે, પરિણામે સાધકનું ધ્યાન પોતાના ધ્યેયથી વિચારિત થાય છે.

અપરિગ્રહ વ્રત સાધકને માનસિક શાંતિ આપે છે અને તેના સમુચ્ચિત અને દીર્ଘકાલીન પાલનથી અહંકાર ક્ષીણ થતો જાય છે.

## (૨) નિયમ :

**શૌચસંતોષતપ:** સ્વાધ્યાયેશવરપ્રણિધાનાનિ નિયમા: યો.સૂ. ૨-૩૨

અર્થાત् શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન આ પાંચ નિયમો છે.

## શૌચ :

શૌચ એટલે પવિત્રતા. આધ્યાત્મિક માર્ગ ચાલનાર સાધક માટે શૌચ એટલે તનની અને મનની પવિત્રતા. તનની

પવિત્રતા બે પ્રકારની છે. બાધ્યપવિત્રતા અને આંતર્દ્ધપવિત્રતા. બાધ્યપવિત્રતા એટલે સ્નાનાદિકથી શરીરની બાધ સપાઈને સ્વચ્છ રાખવું તે અને આંતર્દ્ધપવિત્રતા એટલે નેતિ, ધૌતિ, ખસ્ત વગેરે શોધન ડિયાઓથી શરીરના અંદરના અવયવોને શુદ્ધ કરવા તે. મનની પવિત્રતા એટલે મનના અશુભ વિચારો, દુર્જુણો, આવેગો, લાગણીઓ, કામ, કોધ, લોલ, મોહ, મદ, મત્સર જેવા દોષો-વૃત્તિઓનું શુદ્ધિકરણ કરવું તે.

જ્યાં સુધી તનની અને મનની પવિત્રતા ન પ્રગટે ત્યાં સુધી સાધકના ચિત્તમાં એકાગ્રતા, સ્થિરતા, પ્રસત્તતા, તટસ્થતા અને શાંતિ ન પ્રગટે અને ત્યાં સુધી સાધક આધ્યાત્મિક માર્ગે ન ચાલી શકે.

### સંતોષ :

જે સાધક સંતોષની વૃત્તિ કેળવે તો એના જીવનમાં એકાગ્રતા અને સ્થિરતા આવે છે. એનું મન શાંત થાય છે ને મનના સંકલ્પ-વિકલ્પ ઓછા થાય છે. તૃષ્ણા અને ભ્રમણાનો અંત આવે છે. વળી, પરાવલંબન મટી જાય છે. બીજના પર આધાર રાખવાની વૃત્તિનો અંત આવે છે, પરિણામે ઉત્તમ પ્રકારના સુખનો અનુભવ મળે છે.

અસંતોષી સાધક નિરંતરનો અનુભવ કરી શકતો નથી. નવી ઉપલબ્ધીઓ પ્રાપ્ત કરવાની દોષધામમાં જ એનો સમય વેડફાય છે. સાધક એકાગ્રતા ગુમાવે છે, માટે આ માર્ગે ચાલનાર સાધક સંતોષ કેળવવો પડે જ.

### તપ :

તપ એટલે કોઈ નિશ્ચિત ધ્યેયની પ્રાપ્તિ માટે ગમે તે સંભેગોમાં પૂરા પ્રયત્નશીલ થવું એ તપ છે. પવિત્રતા, સંયમી જીવન, ત્યાગ, સાદગીભર્યું જીવન વિગેરેનો તપમાં સમાવેશ થાય છે. દેહને અને ઇંદ્રિયોને આ હેતુસિદ્ધ માટે કષ આપવું, સહનશીલતા કેળવવી આ પણ એક તપ છે. પ્રભુપ્રાપ્તિ માટે નડતી બધી ઈચ્છાઓ, આકાંક્ષાઓ, મહત્વાકાંક્ષાઓ વિગેરેને જગત રહી બાળી નાખવી એ તપ છે.

તપના ત્રણ પ્રકાર છે. (૧) કાચિક તપ (૨) વાચિક તપ અને (૩) માનસિક તપ. વ્રત, ઉપવાસ, સ્નાન, ઊંઘ, આહાર પરનો સંયમ, અહિંસા, બ્રહ્મયર્થ એ કાચિક તપ એટલે કે શારીરિક તપ છે. પ્રભુના ગુણ ગાવા, સત્ય, પ્રિય અને હિતકર જ બોલવું, કટુવચન ન બોલવું એ વાચિક એટલે કે વાળીનું તપ છે. અવળા વિચારેનો ત્યાગ, સુખદૂઃખમાં સમભાવ, માન-અપમાનમાં એકતા, આત્મસંયમ વિગેરે માનસિક તપ છે. જેમ સોનું અભિમાં તપાવવાથી શુદ્ધ બને છે તેમ સાધક તપ દ્વારા શુદ્ધ બને છે.

### સ્વાધ્યાય :

‘સ્વ’નું અધ્યયન એટલે સ્વાધ્યાય. પોતાની જાતની નિરંતર તપાસ કરતા રહેવું તે સ્વાધ્યાય. આધ્યાત્મિક માર્ગે ચાલનાર સાધક પોતે ક્યાં પહોંચ્યો છે તેની તપાસ પોતે કરવી અને એ માર્ગે નડતા અવરોધોને ઓળખવા ને તેને કેવી રીતે દૂર કરવા માટેનું મનન ચિંતન કરવું તેનું નામ સ્વાધ્યાય. સ્વાધ્યાયનો બીજે અર્થ આધ્યાત્મિક માર્ગે ઉપયોગી એવાં શાસ્ત્રોનું અધ્યયન કરવું, એ માર્ગે ચાલેલા સંતોનો, યોગીઓનો સમાગમ કરવો તે સ્વાધ્યાય. સ્વાધ્યાય એટલે પોતામાં રહેલાં દૈવી તેમ જ આસુરી તત્ત્વોને ઓળખી, દૈવી તત્ત્વોમાં વધારો કરવો અને આસુરી તત્ત્વોનો નાશ કરતાં શીખવું એનું નામ સ્વાધ્યાય.

સ્વાધ્યાયથી સાધકની પ્રભુ તરફની યાત્રામાં વેગ આવે છે, એની સાધના સરળ અને સુગમ બને છે.

### ઇશ્વરપ્રણિધાન :

ઇશ્વરપ્રણિધાન એટલે ઇશ્વરને સમર્પણ. પોતાની સર્વ ઈચ્છાઓ, આકાંક્ષાઓ, વિચારો અને કર્મોને પરમાત્માના ચરણોમાં નિરંતર સમર્પિત કરતા રહેવું એનું નામ ઇશ્વરપ્રણિધાન. મન, બુદ્ધિ અને પોતાની તમામ ઈચ્છાઓનું સમર્પણ એ શ્રેષ્ઠ સમર્પણ છે અને એ જ સાચી ભક્તિ છે. પછી સાધકના જીવનમાંથી ‘હું’ અને ‘મારું’ નીકળી જાય છે. કેવળ ‘તું’ જ રહે છે.

આવા સમર્પણ દ્વારા સાધકના અહંકારનું વિસર્જન થાય છે અને તેનો સમાધિમાં પ્રવેશ થાય છે. તેથી જ મહર્ષિ

પતંજલિએ યોગસૂત્રમાં કહ્યું છે...

સમાધિસિદ્ધરીશવર પ્રગિધાનાત् ।      યો.સૂ. ૨-૪૫

અર્થાત् ઈશ્વરપ્રણિધાનથી સમાધિ સિદ્ધ થાય છે.

### (૩) આસન :

અષ્ટંગયોગનું ત્રીજું અંગ આસન છે. આસન એ કોઈ વ્યાયામ-પદ્ધતિ નથી કે અંગ-કસરતોના પ્રયોગો નથી. મહર્ષિ પતંજલિ આસનની વાત કરતાં કહે છે...

સ્થિરસુખમાસનમ् । યો.સૂ. ૨-૪૭

શરીરને સ્થિર તથા સુખપૂર્વક રાખવાની સિથિતિને આસન કહે છે. આસન એ શરીર અને મનની એક એવી સિથિતિ છે જે શરીરને દઢતા અને મનને સ્થિરતા આપી, તેમને આધ્યાત્મિક વિકાસ માટે તૈયાર કરે છે. આસનથી શરીરનાં અંગો સ્થિર, નિરામય અને હળવાં બને છે. આસન શરીરનો થાક દૂર કરી શરીર અને ઈન્ડ્રિયોને સ્કૂર્તિમાન અને પ્રકુલ્પિત રાખે છે. આસનનો નિયમિત અભ્યાસ સમગ્ર શરીરને તંદુરસ્તી બક્ષે છે.

### (૪) પ્રાણાયામ :

પ્રાણાયામ એ યોગનું ચોંધું અંગ છે. પ્રાણ એટલે ધ્યાસ, વાયુ, જીવનશક્તિ... આયામ એટલે લંબાવવું, ખેંચવું, સંયમિત કરવું, નિયમન કરવું. એટલે પ્રાણનું નિયમન કરવું, પ્રાણનો નિરોધ કરવો તેનું નામ પ્રાણાયામ.

મહર્ષિ પતંજલિ પ્રાણાયામની વ્યાખ્યા આપતાં કહે છે..

તરસ્મિન્ સતિશવાસપ્રશ્વાસયોગતિ વિચ્છેદ: પ્રાણાયામ: ॥      યો.સૂ. ૨-૪૮

અર્થાત् તેમાં (આસનમાં) સિથિત થઈને ધ્યાસ-પ્રશ્વાસની ગતિમાં વિચ્છેદ એટલે પ્રાણાયામ.

ધ્યાસની સતત વહેતી ગતિમાં વિચ્છેદ એટલે કુંભકને અહીં પ્રાણાયામ ગણવામાં આવે છે. કુંભકના આંતર, બાહ્ય, સ્તંભવૃત્તિ અને કેવલ - એમ ચાર પ્રકારો છે.

પ્રાણાયામના અભ્યાસથી પ્રાણની શુદ્ધિ થાય છે, મનની ચંચળતા મટે છે, મન સ્થિર અને એકાગ્ર બને છે. જીવન નવી સ્કૂર્તિ, નવી તાજગી અને નવા તરવરાટથી ભરાઈ જય છે. આરોગ્યની જણવણીનો લાભ મળે છે. સાધકની અંદર જે અશાનનું આવરણ છે તે પ્રાણાયામથી દૂર થાય છે. શાનની કળા ખીલે છે અને મન ધારણા આદિ અભ્યાસ માટે તૈયાર થાય છે.

### (૫) પ્રત્યાહાર :

યોગના પાંચમાં અંગ પ્રત્યાહારની વ્યાખ્યા આપતાં મહર્ષિ પતંજલિ સમજવે છે...

સ્વસ્વવિષયાસમ્પ્રયોગે ચિત્તસ્વરૂપાનુકાર ઇવેન્દ્રિયાણાં પ્રત્યાહાર: ॥      યો.સૂ. ૨-૫૪

અર્થાત् બધી ઈન્ડ્રિયો પોતપોતાના વિષયોમાંથી પાછી હૃદીને ચિત્તસ્વરૂપ આકાર ધારણ કરે અથવા અંતર્મુખ થાય તે પ્રત્યાહાર છે.

આપણી ઈન્ડ્રિયો હુંમેશા વિષયસન્મુખ જ હોય છે. ઈન્ડ્રિયોનો આહાર મલિન હોય તો ચિત્ત ભષ થાય છે. જ્યાં સુધી સાધકનું ચિત્ત બાહ્ય જગતના વિષયોમાં રમમાણ હોય છે ત્યાં સુધી તે અધ્યાત્મ માર્ગે પ્રગતિ કરી શકતો નથી. જો સાધક પ્રત્યાહાર કરતાં શીખી જય તો ધારણા, ધ્યાન આદિ અંતરંગયોગની સાધના માટેનો માર્ગ સુગમ થઈ જય છે. સાધક પોતાની ઈન્ડ્રિયો પર પૂરેપૂરો કાબૂ મેળવી લે છે, ઈન્ડ્રિયોની ગુલાભીમાંથી મુક્તિ મેળવે છે અને જેણો પોતાની ઈન્ડ્રિયોને અને મનને જીતી લીધું એણે આખું જગત જીતી લીધું એમ જ સમજવું.

## (૬) ધારણા :

અષ્ટંગયોગના આ છઠા અંગ - ધારણાની વ્યાખ્યા આપતાં મહર્ષિ પતંજલિ કહે છે...

દેશબન્ધશ્રિતસ્ય ધારણા ॥ યો.સૂ. ૩-૧

અર્થાત् ધારણા એટલે ચિત્તનું કોઈ એક નિશ્ચિત વિષય પર એકાગ્ર થવું.

ધારણા અંતરંગયોગનું પ્રથમ સોપાન છે. ધારણામાં સાધક કોઈ એક વિષય પર મન એકાગ્ર કરે છે અને પોતાના ઈષ્ટ વિષય પર પોતાના ચિત્તને સંયમિત કરે છે ત્યારે ધારણા સિદ્ધ થાય છે. એ વિષયમાં પોતાના ઈષ્ટદેવની કે ગુણી મૂર્તિ, નાસાગ્ર, ભૂમધ્ય, મૂલાધાર, સ્વાધિષ્ઠાન, અનાહત એ આદિક ચક અથવા ઈષ્ટદેવનું મનોમય સ્વરૂપ પણ રાખી શકાય.

## (૭) ધ્યાન :

મહર્ષિ પતંજલિ ધ્યાનનો અર્થ સમજવે છે...

તત્ત્વ પ્રત્યેકતાનતા ધ્યાનમ् । યો.સૂ. ૩-૨

અર્થાત् ધારણાના વિષયમાં ચિત્તવૃત્તિઓની એકતાનતા એટલે ધ્યાન.

ધારણાના એકધારા અભ્યાસથી ચિત્તની વૃત્તિ જે પોતાના ઈષ્ટ વિષયમાં લાગી હોય તેમાં બરાબર જોડાઈ જય અને પાણીના એકધારા પ્રવાહની પેંઠે એકતાનતાથી વહેવા માડે તેને ધ્યાન કહે છે. ધ્યાન એ ધારણાનું પરિપક્વ સ્વરૂપ છે.

## (૮) સમાધિ :

સમાધિ એ અષ્ટંગયોગનું આઠમું અને અંતિમ અંગ છે. ધ્યાનની સર્વોચ્ચ દર્શાએ સાધક સમાધિની અવસ્થાએ પહોંચે છે.

મહર્ષિ પતંજલિ સમાધિની વ્યાખ્યા આપતાં કહે છે...

તદેવાર્થમાત્રનિર્ભસં સ્વરૂપશૂન્યમિવ સમાધિ: । યો.સૂ. ૩-૩

ધ્યાન જ્યારે વધતાં વધતાં અત્યંત ગાઢ બની જય છે ત્યારે ચિત્ત પોતાના ધ્યેયપદાર્થમાં દૂષ્ટી જય છે. પોતાના સ્વરૂપને તદ્દન ભૂલી જય છે ને કેવળ ધ્યેયની જ સત્તા બાકી રહે છે. એવી દર્શાને સમાધિ કહેવામાં આવે છે. ધ્યાતા, ધ્યાન ને ધ્યેય જ્યારે એક થઈ જય છે ત્યારે એકતાની એ અવસ્થાને સમાધિ કહેવાય છે. આ અવસ્થામાં આત્માનું પરમાત્મા સાથે મિલન થાય છે.